

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦,૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૮/૨૦૧૭ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા :-

સમાચાર યાદી નં.૧૭૪૧/૧૭

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ૫૩ કેસ કરી, ૪૭ વ્યક્તિઓને ઝડપી, ૨૭૦ લીટર દેશી દારૂ, ૭૦ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૭૦ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૨૪ બીયરટીન, ૦૧ એક્ટીવા અને ૦૧ મોટર સાયકલ કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૦૨ કેસ કરી, ૦૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૪,૮૭૦/- અને જુગારનાં સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૭૪૨/૧૭

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી-૯૩ મુજબ ૦૭ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઘરફોડ ચોરી :-

સમાચાર યાદી નં.૧૭૪૩/૧૭

ઘાટલોડીયા : અંકીતભાઈ શરદભાઈ પ્રજાપતી (રહે,ચંદ્રલોક સોસાયટી, સુભાષચોક પાસે મેમનગર) એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૮/૧૭ રાતના ૧૧/૦૦ થી તા.૨૮/૮/૧૭ સવારનાં ૭/૪૫ વાગ્યા દરમ્યાન પોતાના બંધ મકાનનાં દરવાજા આગળની લોખંડની જાળીનો નકુચો અને દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ મકાનમાં પ્રવેશ કરી, તીજોરીમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૬૭,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી કમલેશભાઈ કાળાભાઈ ચલાવે છે.

દરીયાપુર : ફાયઝા વા/ઓ નદીમબેગ મીર્ઝા (રહે, રોશનગલી, ચંદન તલાવડી દરીયાપુર)એ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૭/૦૮/૧૭ બપોરના ૩/૦૦ થી રાતનાં ૮/૦૦ વાગ્યા દરમ્યાન પોતાના ભાડાનાં રહેણાંક મકાનનાં દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ પ્રવેશ કરી, તીજોરીમાંથી સોનાનાં દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા ૪૯,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી પી.આર.જાડેજા ચલાવે છે.

સોનાનો દોરો ખેંચી તોડી લઇ ગયા :-

સમાચાર યાદી નં.૧૭૪૪/૧૭

શાહીબાગ : રમીલાબેન વા/ઓ જશવંતભાઈ પટેલ (ઉ.વ.૫૦)(રહે,પેરેલાઈજ પાર્ક ચંદ્રલોક બસ સ્ટેન્ડની બાજુમાં ડફનાળા શાહીબાગ) એ શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૦૮/૧૭ ના કલાક ૬/૩૦ વાગ્યાનાં સુમારે ડફનાળા રોડ પર આવેલ નવરોજી હોલની આગળ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા દરમિયાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ (૩૦ થી ૩૫ વર્ષના આશરનાં) રમીલાબેનનાં ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂપિયા ૩૮,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા.આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એ.પટેલ ચલાવે છે.

કરંટ લાગતાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૭૪૫/૧૭

દરીયાપુર : હૈદરઅલી રજાહુશેન માસ્ટર (ઉ.વ.૬૯)(રહે,અલિ કુલી મુલ્લારાહની પોળ, પાંચપટ્ટી કાલુ પુર તા.૨૭/૦૮/૧૭ રાતના ૮/૦૦ વાગ્યાનાં સુમારે દરીયાપુર ડાહ્યાભાઈની પોળ ખાતે મસ્જીદમાં કામ કરતી વખતે હૈદરઅલીને ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા, સારવાર અર્થે તેમને વા.સા.હોસ્પિટલમાં લાવેલ જ્યાં સારવાર દરમિયાન રાતનાં ૮/૫૦ વાગે ફરજ પરનાં ડોશ્રીએ તેમને મૃત જાહેર કર્યા હતા આ અંગે દરીયાપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એસ.સિંઘવ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.